



સમયદાન કાર્યક્રમ

સ્વૈચ્છિક સેવા માટેનું નોંધણી પત્રક

- નોંધ:-** ૧. આ ફોર્મ ગ્રામપંચાયત, તાલુકાપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જનસેવા કેન્દ્ર પર ભરીને આપવાનું રહેશે.
૨. આ ફોર્મ www.gujaratindia.com, www.swarnimgujarat.org અને www.gujarat-education.gov.in,
www.swarnimgujarat-urban.com પરથી ઓનલાઇન પણ ભરી શકાશે. (ફોર્મ ફીજીકલ ભરીને આપવું અથવા વેબસાઇટ પરથી ઓનલાઇન ભરવું અને કોઇપણ એક રીતે જ ભરીને રજૂ કરવું.)

નામ:- _____

સરનામું:- _____

શહેર/ગામનું નામ:- _____ તાલુકો:- _____ જિલ્લો:- _____

ઉંમર:- _____ વર્ષ

જાતિ:- પુરુષ સ્ત્રી (લાગુ પડતી વસ્તુ સામે ✓ કરો.)

લગ્ન વિષયક દરજ્જો:- પરણિત અપરણિત (લાગુ પડતી વસ્તુ સામે ✓ કરો.)

વ્યવસાય (ડ્રોપ ડાઉન મેનુ માથી સીલેક્ટ કરવું) :-

ઇ-મેઇલ એડ્રેસ:- _____

મોબાઇલ નંબર:- _____

ફોન નંબર (રહેઠાણ) _____

ફોન નંબર (ઓફિસ) _____

કયા ક્ષેત્રમાં યોગદાન આપવા ઇચ્છો છો? (ખાસ નોંધ:- “ શિક્ષણ”, “ આરોગ્ય”, “સફાઈ” અથવા “વન અને પર્યાવરણ” ક્ષેત્ર માંથી કોઇ પણ એક ક્ષેત્ર પસંદ કરી તે ક્ષેત્રમાં ઉપલબ્ધ કામગીરી માંથી પસંદગીની કામગીરી સામે ✓ કરો.)

શિક્ષણ:-

- “સરસ્વતી યાત્રા” - પ્રોઢ શિક્ષણ વર્ગ
- “ગુણોત્સવ” - નબળા વિદ્યાર્થીઓ માટે પુરક વર્ગ
- “વાંચે ગુજરાત અભિયાન” - લોકોમાં વાંચનની અભિરૂચિ કેળવવા માટેનો કાર્યક્રમ

આરોગ્ય:-

- માર્ગદર્શિત બાબતો વિશે રાજ્યના સ્કુલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ સહાયક માર્ગદર્શન પુરૂ પાડવું.
- મમતા અભિયાન હેઠળ વિવિધ સ્થળે જેવા કે તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગર્ભવતી માતાઓની સહાયતા અને સંભાળ કરવી.
- ટીબી રોકવાના પ્રોગ્રામમાં DOT સેવાઓની ભાગીદારી નક્કી કરવી જેની સાથે એ પણ ખાત્રી કરવી કે ટીબીના દર્દીઓ તેમના ઘરે પણ નિયમીત રીતે દવા લે છે.

(પાછળ)

- આરોગ્ય જાગૃતિ માટેના કેમ્પ, રક્તદાન શિબિર અને ચક્ષુદાન શિબિરોનું આયોજન કરવું.
- રોગ થાય જ નહીં તે માટે શાળા, આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં સ્વચ્છતા માટેની ટેવ પાડવાની ગુંબેશ

સફાઇ (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ):-

- સ્થાનિક સ્વરાજની સંસ્થાના માર્ગદર્શન હેઠળ સ્વૈચ્છિક રીતે સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાના કામની જાગૃતિમાં જોડાવું.

વન અને પર્યાવરણ ક્ષેત્ર:-

- સામુહિક વાવેતર માટે સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરવા, સામુહિક વાવેતરનું આયોજન કરાવવું અને વર્ષ દરમિયાન આ રોપાઓનું રક્ષણ કરવું અને પાણી આપવું.
- ઘરે ઘરે છોડની જાતવાર જરૂરિયાત જાતવાર ભેગી કરવી. છોડને લગાવવા માટેના સ્થળને અનુરૂપ જે તે વ્યક્તિને સૂચન કરવા અને વિભાગ સાથે આ રોપાઓ પહોંચાડવા માટેનું આયોજન કરવું.
- ખુલ્લામાં કચરો બાળતા લોકોને સમજાવીને કચરામાંથી જૈવિક ખાતર બનાવવું.
- ધુમાડો રોકવા, બળતણ બચાવવા અને વાતાવરણના રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો, ચાર રસ્તા / કોર્સિંગ ઉપર એન્જીન બંધ કરવા અને બ્રેકનો ઉપયોગ ઘટાડવો.
- પર્યાવરણ સુરક્ષા માટે અને પાણી બચાવવા માટે લોકોમાં જાગૃતતા ઉભી કરવા માટેનું કામ .

અઠવાડિયામાં કેટલા દિવસ યોગદાન આપવા ઇચ્છો છો? :-

દિવસ પ્રમાણે અનુકૂળ સમય:-

| વારનું નામ | અનુકૂળ સમય |
|------------|------------|
| સોમવાર | |
| મંગળવાર | |
| બુધવાર | |
| ગુરુવાર | |
| શુક્રવાર | |
| શનિવાર | |
| રવિવાર | |

સહી:-

ફોર્મ ભર્યાની તારીખ:-